

જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૧૧/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી :-

સમાચાર યાદી નં.૨૨૨૯/૧૭

અમદાવાદ શહેરના ચેઇન સ્નેચીંગના જુદા જુદા ૨૧ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતો ફરતો રીઢો ગુનેગારને પકડી પાડતી અમદાવાદ શહેરએસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ

સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કાઇમબ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા સારું આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં એસ્પો.જી.ના પોસઇ શ્રી વી.એચ.જાડેજા તથા પો.સ.ઇ. શ્રી એમ.કે.ઝાલા નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન પો.કો.જીતેન્દ્રકુમાર ત્રિકમલાલ તથા પો.કો. નિશારઅહેમદ ઉસ્માનમીયા નાઓએ આપેલ બાતમી હકીકત આધારે પીરાણા દેવ હોટલ ચાર રસ્તા ખાતેથી આરોપી મોહમદશાહીદ ઇકબાલભાઇ કુરેશી ઉ.વ.૩૫ ધંધો:વેપાર રહે, મ.નં.૨૮૯૬, દાદામીયાંની ગલી, મામુજીનો ખાંચો પોપટીયાવાડ, દરિયાપુર, અમદાવાદ શહેરને પલ્સર મો.સા. સાથે ઝડપી લેવામાં આવેલ જેની પુછપરછ કરતાં ઉપરોક્ત મો.સા. ઉપર પોતે તથા પોતાના મિત્ર જોએબખાન નાદીરખાન બલોચ નાઓએ ભેગા મળી દાણીલીમડા, પાલડી, ઓઢવ, બાપુનગર, સરદારનગર, વસ્ત્રાપુર, શાહીબાગ પોલીસ સ્ટેશન, વાડજ, માધુપુરા દરિયાપુર, એલીસબ્રીજ, ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ કરેલાની કબુલાત કરેલ અને આ ગુનામાં જોએબખાન અગાઉ પકડાયેલ અને પોતે ગુનામાં નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ. જેથી પલ્સર મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- નુ કબ્જે કરવામાં આવેલ અને સદરી ઇસમને આજરોજ તા.૦૩/૧૧/૨૦૧૭ ના કલાક ૧૬/૦૦ વાગે સીઆરપીસી કલમ ૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી સારું તજવીજ હાથ ધરેલ છે.

આ આરોપી અગાઉ સને ૨૦૧૨ ની સાલમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ સને ૨૦૧૩ માં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તેમજ સને ૨૦૧૪ માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમજ સને ૨૦૧૬ માં મણીનગર પોલીસ સ્ટેશનમાં તેમજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓમાં પકડાયેલ છે

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.